

લિંબાયત પો.સ્ટે.દાખલ થયેલા ગુ.ર.નં. ૮૬/૨૦૧૯ ઇ.પી.કો. કલમ-૩૫૬, ૩૭૯, ૧૧૪ મુજબના
ગુન્હાના કામે આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી, ઉઘના પોલીસ.

સુરત શહેરના ઉઘના પો.સ્ટે. વિસ્તારમાં મોબાઈલ સ્નેચીંગના બનાવ અનુસંધાને પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પ્રો.એ.એસ.આઇ ધીરજભાઈ રાઘવભાઈ બથવાર તથા અ.પો.કો. કુલદીપભાઈ દિલુભાઈનાઓને મળેલ બાતમી હકીકત આધારે બે ઇસમો ઉઘના સ્વામિનારાયણ મંદિર પાસે એક ઇસમે શરીરે રીંગણી કલરનો શર્ટ તથા સ્કાય બ્લૂ કલરનું પેન્ટ તથા બીજો ઇસમ જેણે શરીરે લાલ કલરનું ટી-શર્ટ તથા બ્લૂ કલરનું પેન્ટ પહેરેલ હોય, જેઓની પાસે હોન્ડા કંપનીની બ્લૂ કલરની લીઓ બાઇક છે. જે ચોરીના મોબાઇલ વેચવા માટે ઉભા હોઇ જેમની પાસે હાલમાં ચોરીના બે મોબાઇલ હોય વિગેરે મતલબની બાતમી હકીકત આધારે સદર બાતમીવાળી જગ્યાએ પહોચી બંને ઇસમોનું નામદામ પુછતા તેમાંથી નં.(૧)નાએ પોતાનું નામ વિજય હિંમત બાગુલ ઉં.વ.૨૧ ધંધો. નોકરી રહે. ફ્લેટ નં.૩૦૪, આકાર રેસીડન્સી, શાંતીનગર, નિલગીરી, લિંબાયત, સુરત શહેર તથા નં.(૨) વિકી દિપકભાઈ નિખારે ઉં.વ.૨૨ ધંધો. હાલ બેકાર રહે. ઘર નં.૧૦૬, રંગીલાનગર બજરંગ દળ મંદિર નીલગીરી લિંબાયત, સુરતના હોવાનું જણાવેલ. મજકુર ઇસમોની અંગ ઝડતી કરતા આરોપી નં.(૧) ના ખિસ્સામાંથી એક MA કંપનીનો note 5 મોબાઇલ જેની કિંમત આશરે કિંમત ૪૦૦૦/-ગણી શકાય જેનો નં.(૧) 869444039218268 તથા IME નં. (૨) 869444039218276 નો હોય તથા આરોપી નં.(૨) ના પેન્ટના ખિસ્સામાંથી એક OPPO કંપનીનો A 3 S ડાર્ક રેડ કલરનો જેની આશરે કિંમત :- ૪૦૦૦/- નો મળી આવેલ જેથી બંને મોબાઇલ બાબતે તેઓની આધાર પુરાવા બાબતે પુછતા ગલ્લા તલ્લા કરી, ઉડાવ જવાબ આપેલ અને કોઈ પણ પુરાવા રજુ નહી કરી બંને ઇસમોએ છળકપટથી મેળવેલ હોવાનું જણાતા સદર ઇસમોને વધુ પુછપરછ કરતા બંને મોબાઇલ ફોન આજથી સાતેક દિવસ પહેલા લીંબાયત ગોડાદરા મેઈન રોડ ઉપરથી ફોન અલગ અલગ વ્યક્તિઓ પાસેથી સ્નેચીંગ કરેલ હોવાનું જણાવેલ, બંને મોબાઇલ કિ.રૂ ૮૦૦૦/- તથા ગુન્હામાં ઉપયોગમાં લીધેલ મો.સા. કિ.રૂ ૩૦,૦૦૦/- મળી કુલ્લે રૂપિયા ૩૮,૦૦૦/- ના મત્તાની ચોરી કરેલ હોય, જે લીંબાયત પો.સ્ટે. । ગુ.ર.નં. ૮૬/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૫૬, ૩૭૯, ૧૧૪ મુજબનો ગુન્હો દાખલ થયેલ જે વણશોધાયેલ હોય, જે ગુન્હો શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે.